



सत्यमेव जयते

# The Gujarat Government Gazette

## EXTRAORDINARY

### PUBLISHED BY AUTHORITY

Vol. LXV ]

THURSDAY, JULY 25, 2024 / SRAVANA 3, 1946

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

#### PART IV-C

**Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including those made by the Government of India, the High Courts, the Director of Municipalities, the Commissioner of Police, the Director of Prohibition and Excise, the District Magistrates and the Election Commission, Election Tribunals, Returning Officers and other authorities under the Election Commission.**

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

જાહેરનામા

ગાંધીનગર, ૨૫મી જુલાઈ, ૨૦૨૪

**GERC-REG-T1-01/11-2024:** કોરીએન્ડમ-ઈન-નોટીફિકેશન નં. ૦૧/૨૦૨૩ના ગુજરાત રાજપત્ર (અસાધારણ PART IV-C)માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સન ૨૦૨૪ના જાહેરનામા ક્રમાંક ૦૧નો ગુજરાતી અનુવાદ આથી સર્વે લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

સ્થળ: ગાંધીનગર

તારીખ: ૨૫/૭/૨૦૨૪

રંજીથકુમાર જે., આઈએએસ,

સચિવ.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) ગાંધીનગર

૨૦૨૪ ના જાહેરાત ક્રમાંક. ૦૧ સુધારો

**GERC-REG-T1-01/11-2024:-** વિદ્યુત અધિનિયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ના અધિનિયમ ક્રમાંક ૩૬માં)ની કલમ ૫૦ સાથે વાંચતા, કલમ ૧૮૧(૨) (૨), અને ગુજરાત વીજ ઉદ્યોગ (પુન: રચના અને નિયમન) અધિનિયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ના ગુજરાત અધિનિયમ ક્રમાંક ૨૪માં)ની કલમ ૪૨(૧)(બી) અને તે અર્થે તેને સક્ષમ બનાવતી તમામ સત્તાની રૂએ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગને ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(વીજ પુરવઠા સંહિતા અને સંલગ્ન બાબતો)નિયમ, ૨૦૧૫માં તા.૦૫.૧૨.૨૦૨૩એ સુધારેલ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (વીજ પુરવઠા અને સંલગ્ન બાબતો) (ત્રીજો સુધારો) નિયમ, ૨૦૨૩નું જાહેરનામા ક.૧ મા સુધારો કરેલ.

ઉપર દર્શાવેલ જાહેરનામામાં નીચે મુજબની બાબતો સુધારવી.

૧. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(વીજ પુરવઠા અને સંલગ્ન બાબતો)(ત્રીજો સુધારો) વિનિયમ, ૨૦૨૩ની કલમ ૨.૩(૩), હવેથી નીચે મુજબ વંચાશે;

‘અરજદાર’ એ વીજ અધિનિયમ, તે હેઠળ કરેલા નિયમો અને વિનિયમોની અથવા અન્ય સેવાઓની જોગવાઈ ઓ અનુસાર કોઈ જમીન/જગ્યાના માલિક કે કબજેદાર કે જેણે વિદ્યુત પુરવઠા માટે વર્ગ મંજૂર વીજ ભાર/કરાર માંગમાં વધારો કે ઘટાડો કરવા, શીર્ષકમાં ફેરફાર, નામમાં ફેરફાર, ગ્રાહકમાં ફેરફાર, પુરવઠાનું જોડાણ તોડવું અથવા પુન : સ્થાપન કરવું અથવા કરારની સમાપ્તિ, જોડાણ અથવા યથાપ્રસંગ, અન્ય સેવાઓને ખસેડવા માટે વિતરણ પરવાનેદાર સમક્ષ અરજી પત્રક રજૂ કરે છે તેનો ઉલ્લેખ કરે છે;

૨. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(વીજ પુરવઠા અને સંલગ્ન બાબતો)(ત્રીજો સુધારો) વિનિયમ, ૨૦૨૩ની કલમ ૪.૩૨ હવેથી નીચે મુજબ વંચાશે;

એચ.ટી./ઈ.એચ.ટી. પુરવઠા માટેની અરજીના કેસમાં, પરવાનેદાર અરજી મળ્યાના બે કામકાજના દિવસની અંદર તેને પ્રવહન પરવાનેદારને ગ્રીડ સંહિતાની જોગવાઈઓના સંદર્ભમાં તેની આગળની પ્રક્રિયા માટે મોકલાશે. પ્રવહન પરવાનેદાર, વિતરણ પરવાનેદાર પાસેથી અરજી મળ્યાના ૫ (પાંચ) કામકાજના દિવસમાં અરજીની શક્યતા અથવા અન્યથા બાબત અંગે વિતરણ પરવાનેદારને જાણ કરશે. પ્રવહન પરવાનેદારની ટિપ્પણીઓ, અરજદારને એ જ દિવસની અંદર જણાવાશે.

અરજી શક્ય હોય તેવા કેસમાં અને ઉપરના ખંડ ૪.૨૯ માં જોગવાઈ કર્યા મુજબ પાલનને અધીન હોય, તો વિતરણ પરવાનેદાર, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (વિતરણ પરવાનેદારની કામગીરીનું ધોરણ) વિનિયમો, ૨૦૦૫ અને તેના સુધારામાં નિર્દિષ્ટ સમય મર્યાદાની અંદર સ્વીકૃતિ અન્વયે લેખિત ડિમાન્ડ નોટ આપશે:

પરંતુ ઉપરના ખંડ ૪.૨૯ માં જોગવાઈ કર્યા પ્રમાણે પાલન કરવામાં અરજદારે લીધેલા સમયને, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (વિતરણ પરવાનેદારની કામગીરીનું ધોરણ) વિનિયમો, ૨૦૦૫ અને તેના સુધારામાં નિર્દિષ્ટ સમયમર્યાદામાં સમાવિષ્ટ કરાશે નહિ.

૩. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(વીજ પુરવઠા અને સંલગ્ન બાબતો)(ત્રીજો સુધારો) વિનિયમ, ૨૦૨૩ની કલમ ૪.૧૧૦ હવેથી નીચે મુજબ વંચાશે;

તમામ ચુકવણીઓ રોકડથી રૂ.૧૦,૦૦૦ -સુધી (બેન્કરના ચેક કે ડિમાન્ડ ડ્રાફટથી કરાશે .બેન્કરના ચેકો અને ડિમાન્ડ ડ્રાફટ, અનુસૂચિત વાણિજ્યિક બેન્કની કોઈ શાખા પર ચૂકવવાપાત્ર થશે .પરવાનેદારે ડિમાન્ડ નોટની ઈ-ચુકવણી માટે સુવિધા પણ ઊભી કરવી જોઈશે

૪. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(વીજ પુરવઠા અને સંલગ્ન બાબતો)(ત્રીજો સુધારો)નિયમ, ૨૦૨૩ની કલમ ૬.૪૯ હવેથી નીચે મુજબ વંચાશે;

વિતરણ પરવાનેદારે, પ્રિ-પેમેન્ટ મીટર સ્થાપિત કર્યા હોય તે સિવાયના સ્થળોએ વાસ્તવિક મીટર વાંચનના આધારે દરેક બીલીંગ સાઈકલ માટેનું બિલ તૈયાર કરવું જોઈશે. પ્રિ-પેમેન્ટ મીટરોગના કિસ્સામાં, વિતરણ પરવાનેદાર, ગ્રાહકની તેની કે તેણીની વિનંતી પર બિલ આપશે. ગ્રાહકે જરૂરી વિગતો આપી હોય, તો પરવાનેદાર, એસએમએસ અને / ઈ-મેઈલ મારફત રવાનગીની ગ્રાહકને તુરંત જાણ કરશે. આવા બિલમાં બિલ રકમ અને ચુકવણી માટેની નિયત તારીખની વિગતોનો સમાવેશ થશે. વિતરણ પરવાનેદાર, બિલ જનરેશનની તારીખે બિલ તેની વેબસાઈટ પર પણ અપલોડ કરશે. ચુકવણી મળ્યાની વિગતો સાથે તમામ ગ્રાહકો માટેની છેલ્લા એક વર્ષ (છેલ્લામાં છેલ્લા બિલ સહિતની) બિલ ભર્યાની રસીદ સાથેની બિલિંગ વિગતો પરવાનેદારની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ કરાશે. આ સુવિધા માટે પરવાનેદાર પાસે નોંધણી કરાવનાર ગ્રાહકને તેની વિગતો સુલભ થઈ શકશે.

તારીખ: ૦૧-૦૧-૨૦૨૪

સ્થળ: ગાંધીનગર

રણજીથકુમાર જે., IAS,

સચિવશ્રી.

